MUKESH VERMA

Resolution Professional of

M/s IMP-POWERS LTD. (under CIRP), CIN L31300DN1961PLC000232 Email id: ipl.cirp@gmail.com Cell: 9820789105

AVM Resolution Professionals LLP, Nucleus House, Saki Vihar Road, Andheri East, Mumbai 400072 January 12, 2023

To. The Manager. BSE Limited. Listing Department. Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai 400001 Scrip Code: 517571

The Manager. National Stock Exchange of India Limited. Listing Department, Exchange Plaza, 5th floor, Plot no. C/1. G Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai 400051 Symbol: INDLMETER

Dear Sir/Madam,

Sub: Disclosure under Regulation 30 read with Regulation 47(3) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 - Newspaper Publication

Pursuant to Regulation 30, Regulation 47(3) read with Part A of Schedule III of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith the newspaper clipping regarding Notice of the 60 th Annual General Meeting of the Company and E-voting information, published in Financial Express (English Newspaper) and Financial Express (Gujarati Newspaper) on Thursday, January 12, 2023.

You are requested to take the above information on record.

Thanking You. Yours Faithfully,

For IMP POWERS LIMITED

Mukesh Verma

Resolution Professional IMP POWERS LIMITED

IBBI Reg. no. IBBI/IPA-001/IP-P01665/2019-2020/12522

Reg. Address: B1506, Sunteck City Avenue 2, Goregaon West, Mumbai 400104

Reg. Email ID: ip.mukeshverma@gmail.com Email Id for correspondence: ipl.cirp@gmail.com

IP-P-01665 2019-20/ 12522

PUBLIC NOTICE

Estee Advisors Private Limited ("Old Company" or

"Merged Company"), PAN AABCE9657R, PMS

Estee Advisors Private Limited (formerly Estee Fincap

Private Limited "Resultant Company"), PAN

Registered Office: PO5-01A, PO5-01B, PO5-01C,

5th Floor, Tower A, WTC Gift City, Block 51, Road 5E,

Corporate Office: 8th Floor, Block I, Vatika Business

Park, Sohna Road, Sector 49, Gurugram, Haryana -

122001 | Contact No: +91 124 463 7700; Fax: +91 124

Email id: investorsgrievances@esteeadvisors.com

TRANSFER OF PMS ACTIVITIES FROM

'INP000003146' TO 'INP000007720' PURSUANT

TO AMALGAMATION

Notice is hereby given to the General Public that "old

company" Estee Advisors Private Limited having PAN

AABCE9657R, PMS License INP000003146, was

amalgamated with Estee Advisors Private Limited

(formerly Estee Fincap Private Limited) having PAN -

AAFCE5637D, PMS License INP000007720, as per NCLT order dated 3rd May 2021. By virtue of the

amalgamation all the assets, liabilities, registrations, licenses, agreements, contracts, relationships &

employees of old company got transferred to resultant

company including but not limited to PMS registration,

Kindly make note that all the future PMS activities for

the clients will be managed by the resultant company

Estee Advisors Private Limited (formerly Estee Fincap Private Limited) having PAN - AAFCE5637D, PMS

License INP000007720. If anyone has any

grievances, they can lodge the grievances at

For Estee Advisors Private Limited

(DIN: 01111082)

its liabilities, mandates, clients etc.

scores.gov.in.


Zone 5, Gift City, Gandhinagar, Gujarat - 382355

463 7701 | Website: www.esteeadvisors.com

AAFCE5637D, PMS License INP000007720

License INP000003146

FINANCIAL EXPRESS



APPENDIX -IV-A - E-AUCTION-PUBLIC SALE NOTICE OF IMMOVABLE PROPERTY/IES

E-Auction-Sale Notice for Sale of Immoveable Assets Under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002)

Registered Office: 9th Floor, Antriksh Bhawan, 22, K.G. Marg, New Delhi-110 001

PH.: 011-23357171, 23357172, 23705414, Website: www.pnbhousing.com

BRANCH OFFICE: 305-308, THIRD FLOOR, TITANIUM SQUARE, ADAJAN CHAR RASTA, ADAJAN, SURAT, GUJRAT - 395009 BRANCH OFFICE: 2ND FLOOR, PART I, MEGHA HOUSE, OPP. KOTAK BANK, MITHAKHALI LAW GARDEN ROAD, ELLISBRIDGE, AHMEDABAD, GUJRAT - 380006 Notice is hereby given to the public in general and in particular to the borrower(s) & guarantor(s) indicated in Column No. - A that the below described immovable property(jes) described in Column No.-D mortgaged/charged to the Secured Creditor, the constructive/Physical Possession of which has been taken (as described in Column No. - C) by the Authorized Officer of M/s PNB Housing Finance Limited (PNB HFL)/ Secured Creditor, will be sold on "AS IS WHERE IS, AS IS WHAT IS and WHATEVER THERE IS BASIS" as per the details mentioned below Notice is hereby given to borrower(s)/mortgagor(s)/Legal Heirs, Legal Representative, (whether Known or Unknown), executor(s), administrator(s), successor(s), assignee(s) of the respective borrowers/ mortgagor(s)(since deceased) as the case may be indicated in Column No. - A under Rule-8(6) & 9 (1) of the Security Interest Enforcement Rules, 2002 amended as on date. For

Loan No. / Name of the Borrower/Co-Borrower/ Guarantor(s)/Legal heirs (A)	Demanded Amount & Date (B)	Nature of possession	Description of the Properties mortgaged (D)	Reserve Price (RP)	EMD (10% of RP)	Last Date of Submission of Bid	Bid Incre- mental Rate (H)	Inspection Date & Time	Date of Auction & Time	Known Encum- brances /Court Case, if any, (K)
NHL/SRT/0817/418858 Mr. Anil Manilal Patel (Borrower) & Mrs. Pushpaben Anilbhai Patel (Co-Borrower) B.O.: SURAT	Rs. 21,64,593.38 As on date 17-06-2019	(Physical)	Plot No 133, (As Per Approved Plan D 133), Sahkar Bunglows, B/S Mansarovar Residency, Nr Kamrej Toll Plaza, Kathor, Surat, Surat, Gujarat, India, 394180	Rs. 1,81,77,000/-	Rs. 1,81,700/-	27-01-2023	Rs. 20,000/-	21-01-2023 & 10.00 AM To 5.00 PM	28-01-2023 & 11.00 AM To 2.30 PM	Not Known
HOU/SRT/0417/372305 Mrs. Kamladevi Vishnukant Pandey (Borrower) & Mr. Atulkumar Pandey & Mr. Vishnukant Ramlakhan Pandey (Co-Borrower) B.O.: SURAT	Rs. 20,30,540.24 As on date 10-09-2018	(Physical)	Flat No 102 1st Floor, Bldg No A2 As Per Approved Plan A, Anjani Nandan Residency, Saniya Kande Road, Saniya Kande, Surat, Surat, Gujarat, India, 394210	Rs. 13,71,000/-	Rs. 1,37,100/-	27-01-2023	Rs. 10,000/-	& 10.00	28-01-2023 & 11.00 AM To 2.30 PM	Not Known
HOU/SRT/0517/389890 Mr. Sukhdev Ashokbhai Patel (Borrower) & Mrs. Deepika Sukhdev Patel (Co-Borrower) B.O.: SURAT	Rs. 18,69,931.42 As on date 15-06-2019	(Physical)	Plot No 431, (As Per Sanction Plan Plot No A 253), Royal Park 1, B/S. Shiv Shakti Estate, Olpad- Sayan Road, Olpad, Surat, Surat, Gujarat, India, 394540	Rs. 12,66,000/-	Rs. 1,26,600/-	27-01-2023	Rs. 10,000/-	& 10.00	28-01-2023 & 11.00 AM To 2.30 PM	Not Known
NHL/AHM/1018/590102 Mr. Devendrasinh Gohil (Borrower) & Vikramsinh Hakubha Gohil (Co-Borrower) B.O.: AHMEDABAD	Rs. 90,43,122.38 As on date 10-02-2020	(Physical)	103, The Grand Apurva, Op Atul Petrol Pump, Near Digjam Circle, Airport Road, Digjam Circle, Jamnagar Gujarat -361006, India	Rs. 70,50,000/-	Rs. 7,05,000/-	27-01-2023	Rs. 10,000/-	& 10.00	28-01-2023 & 11.00 AM To 2.30 PM	Not Known
00326660000422 & 00326700000423 Dashrathabhai Mahavana (Borrower) & Jyotsnaben Makwana (Co-Borrower) B.O.: AHMEDABAD	Rs. 15,21,536/- As on date 18-02-2016	(Physical)	A-501, Jaideep Apartment Nr Jalaram Temple, Sanand, Gujarat, 382110, Ahmedabad, Gujarat- 382110.	Rs. 13,95,000/-	Rs. 1,39,500/-	27-01-2023	Rs. 10,000/-	21-01-2023 & 10.00 AM To 5.00 PM	28-01-2023 & 11.00 AM To 2.30 PM	Not Known

*Together with the further interest @18% p.a. as applicable, incidental expenses, cost, charges etc. incurred upto the date of payment and/or realization thereof. ** To the best knowledge and information of the authorized Officer of PNB Housing Finance Limited, there are no other encumbrances/ claims in respect of above mentioned immovable secured assets except what is disclosed in the Column No. - K. Further such encumbrances to be catered/paid by the successful purchaser/bidder at his/her end. The prospectiv purchaser(s)/bidders are requested to independently ascertain the veracity of the mentioned encumbrances.

As on date, there is no order restraining and/or court injunction PNBHFL/the authorized Officer of PNBHFL from selling, alienating and/or disposing of the above immovable properties The prospective purchaser/bidder and interested parties may independently take the inspection of the pleading in the proceedings/orders passed etc. if any, stated in Column No. - I Including but not limited to the title of the documents of the title pertaining thereto available with the PNBHFL and satisfy themselves in all respects prior to submitting tender/bid

application form or making Offer(s) The bidder(s) has to sign the terms and conditions of this auction along with the Bid Form. Please note that in terms of Rule 9(3) of the Security Interest (Enforcement) Rules, 2002, the bidder(s)/the purchaser is legally bound to deposit 25% of the amount of sale price, (inclusive of earnest money, if any, deposited) on the same day or not later than next working day. The sale may be confirmed in favour of (bidder(s) only after receipt of 25% of the sale price by the secured creditor in accordance with Rule 9(2) of the Security Interest (Enforcement) Rules, 2002. The remaining 75% of the sale consideration amount has to be deposited by the

purchaser within 15 days' from the date of acknowledgement of sale confirmation letter and in default of such deposit, the property/secured asset shall be resold M/s C1 India Private Limited would be assisting the Authorised officer in conducting sale through an e-Auction having its Corporate office at Plot No. 68, 3rd Floor, Secto 44, Gurgaon, Haryana 122003 Website - www.bankeauctions.com For any assistance related to inspection of the property or obtaining the Bid Documents and for any other query or for registration, you have to co-ordinate with or Mr. Suhag Joshi, email id:- suhag.joshi@pubhousing.com, Mob No. 9289182875, is authorised Person of PNBHFL

PLACE:- SURAT, AHMEDABAD, DATE :- 11-01-2023 Sd/- AUTHORIZED OFFICER, PNB HOUSING FINANCE LIMITED

(T) IDBI BANK CIN:L65190MH2004GOI148838 Gujarat

IDBI Bank Ltd., Ground Floor, 21st Century Bldg, Opp Singapuri Wadi, Ring Road, Surat Pin :395002

APPENDIX IV SEE [RULE 8(1)]

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the authorised officer of IDBI Bank Limited under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of the powers conferred under Section 13(12) read with rule 3 of Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated July 12, 2022 calling upon the borrower M/s Watech RO System (I) Private Limited to repay the amount mentioned in the notice being Rs.8.55,14,982.38/-(Rupees Eight Crores Fifty-five lakhs Fourteen thousand nine-hundred and eighty-two and paise thirty-eight only) within 60 days from the date of the receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below, in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this the 9th day of January of the year 2023.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of IDBI Bank Limited for an amount of Rs.8,55,14,982.38/-(Rupees Eight Crores Fifty-five lakhs Fourteen thousand nine-hundred and eighty-two and paise thirty-eight only) as on July 1,

2022 and interest and other charges thereon with effect from July 2, 2022. The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act. in respect of time available, to redeem the secured assets

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES:

Property No. 1:

All that piece and parcel of land comprised in and forming part of Basement+G+1 bungalow constructed over 2644 sq ft Land and City Survey No. 4542 paiki known as "Prabhu Villa" Opp. Side Road of Shri Bhagawati Complex, Nr. Patidar Ginning & Processing Ltd., M.G. Road, Bardoli, Surat within Sub- registration officer of Surat and

which is bounded as follows: On the East by: Compound of Patidar Ginning & Processing Ltd.

On the West by: Internal Road

On the South by: Adj. land of same survey number On the North by: Main Road

Together with all buildings and structures thereon and all plant and machinery attached to the earth or permanently fastened to anything attached to the earth.

All that piece and parcel of land comprised in and forming part of G+2 building constructed over 7470 sq ft land at Block/S. No. 393/paiki 1/ paiki 5, paiki 2, Surat-Dhuliya Main Raod, Moje-Ten, Tal Bardoli, Dist-Surat and which is bounded as follows:

On the East by: Land of Salimbhai Zinabhai

On the West by: Adj. Land of same survey number On the South by: Land of Salimbhai Zinabhai

On the North by: Surat Dhuliya Road

Together with all buildings and structures thereon and all plant and machinery attached to the earth or permanently fastened to anything attached to the earth.

indianexpress.com

Place: Surat Date: 11/01/2023

Authorised Officer IDBI Bank

Umesh Kumar (Director)

IMP POWERS LIMITED

Corporate Identification Number: L31300DN1961PLC000232 Registered Office: Survey No. 263/3/2/2, Sayli Village, Umar Kuin Road, Silvassa (U. T.) Dadra & Nagar Haveli, Silvassa 396230

Website: www.imp-powers.com Email: cs@imp-powers.com NOTICE OF THE SIXTIETH ANNUAL GENERAL MEETING AND EVOTING INFORMATION

NOTICE is hereby given that the Sixtieth Annual General Meeting (AGM) of the members of IMP Powers Limited ("the Company") will be held on Thursday, February 02, 2023 at 2.00 p.m. (I.S.T.) through Video Conferencing("VC") / Other Audio-Visual Means ("OAVM") to transact the business as set out in the Notice of AGM dated January 10, 2023, without physical presence of the members at a common venue.

In compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made hereunder, read with General Circular No. 02/2022 dated May 05, 2022 and General Circular Nos.21/2021, 19/2021, 02/2021,14/2020, 17/2020 and 20/2020 dated December 14, 2021 December 08, 2021, January 13, 2021, April 08, 2020, April 13, 2020 and May 05, 2020 respectively, issued by the Ministry of Corporate Affairs read with SEBI circulars dated May 13, 2022, January 15, 2021 and May 12, 2020, the Company has sent the Annual Report 2021-22 alongwith Notice of the AGM on January 10, 2023 through electronic mode to all the members whose email IDs are registered with the Depository Participant(s)/ Company/ Link Intime India Private Limited, the Company's Registrar and Share Transfer Agents (RTA).

he Annual Report of the Company for the FY 2021-22 along with Notice of AGM and e-voting instructions is also available on the Company's website (<u>www.imp-powers.com</u>), website of the Stock Exchange(s) i.e. BSE Limited (www.bseinda.com) and National Stock Exchange of India imited (www.nseindia.com) and also on the website of National Securities Depository Limited. "NSDL") (www.evoting.nsdl.com).

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the Listing Regulations, the Company is pleased to provide the Members with the facility to cast their vote electronically ("remote e-voting") as well e-voting at AGM through e-voting services of NSDL is

The voting rights of the Members shall be in proportion to their share in the paid-up equity share capital of the Company as on Thursday, January 26, 2023 ("cut-off date"). Any person, whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories/RTA as on the cut-off date only shall be entitled to cast vote either through remote e-voting or e-voting at the AGM. Any person who acquires the shares of the Company and becomes a Member of the Company after the dispatch of the Notice of AGM and holding shares as on cut-off date, may follow the instructions given in the notice of AGM to caste their vote and

The remote e-voting period shall commence from Monday, January 30, 2023 at 9.00 a.m. and end on Wednesday, February 01, 2023 at 5.00 p.m. (I.S.T.). During this period, Members can select EVEN 123196 to cast their votes electronically. The remote e-voting module shall be disabled by NSDL after 5.00 p.m. on Wednesday, February 01, 2023.

The facility for voting through electronic means shall also be provided at the AGM. Those Members, who are present at the AGM through VC/OAVM facility and have not already cast their votes on the resolutions via remote e-voting shall be eligible to vote through e-voting system during the AGM. The Members, who have cast their vote by remote e-voting prior to AGM, may also attend the AGM through VC/OAVM but shall not be entitled to cast their vote again at the AGM. The procedure and manner to attend AGM and cast vote using e-voting system of NSDL has been provided in the Notice of AGM.

The Members of the Company who have not registered their e-mail address can register the same as per the following procedure:

The members holding shares in physical form may get their email addresses registered with Company's RTA by providing Form ISR-1 duly filled and signed by the Member together with the supporting documents as stated therein.

The members holding shares in demat form may get their email address registered with the respective Depository Participant(s). lowever, for receiving soft copy of Annual Report of FY 2021-22 and Notice of 60° AGM, such

nembers may send an email to cs@imp-powers.com alongwith their details such as Name of shareholder, DPID / Client ID, PAN and mobile number. In case of any queries relating to e-voting, with respect to remote e-voting or e-voting at the AGN

and members may contact NSDL on evoting@nsdl.co.in/1800 1020 990 and 1800 22 44 30 or NSDL at evoting@nsdl.co.in or refer to the Frequently Asked Questions (FAQs) section / e-voting use nanual for shareholders available at the Downloads section on https://www.evoting.nsdl.com.

Place: Mumbai Date: January 10, 2023

Mukesh Verma Resolution Professional



Your apinion should belong to you. A voice that is your own. Undeterred, Uncompromised, And brave. A conscience that isn't at peace, until the truth is uncovered. A mind that isn't fuelled by someone else's thoughts.

and not ignorant assumptions. Because it's not about going where everyone goes.

Where actions are based on informed opinions

Or taking sides because you don't know enough It's about freedom.

Or being part of a trend because it is one.

The freedom to have an opinion that's yours.

At Indian Express, we stand by this freedom. We celebrate it by being unbiased and independent. And by having a voice that isn't afraid to speak its mind.

#InformYourOpinion

The Indian Express. For the Indian Intelligent.



indianexpress.com

♦ The Indian **EXPRESS**

I arrive at a conclusion not an assumption. Inform your opinion with detailed analysis.

The Indian Express. For the Indian Intelligent. **♦** The Indian **EXPRESS** JOURNALISM OF COURAGE -

financialexp.epapr.in

Ahmedabad

PUBLIC ANNOUNCEMENT OF FINAL EXIT OFFER TO THE EQUITY SHAREHOLDERS OF ADHARSHILA CAPITAL SERVICES LIMITED Registered Office: 7c, 1st Floor; 'J' Block Shopping Centre, Saket New Delhi -110017 [Cit: L65100DL1993PLC:056347]
Tel: 011-46107318, E-mail: adharshilacapital@gmail.com

NOTICE
PUBLIC ANNOUNCEMENT OF FINAL EXIT
OFFER TO THE EQUITY SHAREHOLDERS OF

published on January 11, 2023 in this newspaper in the bottom company name should be read as ADHARSHILA CAPITAL SERVICES LIMITED

instead of Pariksha Fin-Invset-Lease Limited. Other

Le Lavoir Limited

CIN: L74110GJ1981PLC103918

Registered Office: Digvijay Plot, Street No. 51 Opposite Makhicha Nivas Jamnagar - 361 005 NOTICE OF EXTRA ORDINARY GENERAL MEETING AND REMOTE E-VOTING INFORMATION

Notice is hereby given that the Extra Ordinary General Meeting ('EGM') of the Members of the Company will be held on Thursday, 2nd January, 2023 at 3:00 P.M. through Video Conferencing (VC) / Other Audio Video Means (OAVM) to transact the special businesses as set out in the notice of EGM.

businesses as set out in the notice of EGM.

EGM will be held through VC/OAVM without physical presence of the Members and in compliance with the applicable provisions of the Companies Act, 2013 ('the Act'') read with rules made thereunder and Circular No. 14/2020 dated April 08, 2020, Circular No.17/2020 dated April 13, 2020 issued by the Ministry of Corporate Affairs followed by Circular No. 20/2020 dated May 05, 2020 and Circular No. 02/2021 dated January 13, 2021 and all other relevant circulars issued from time to time issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('Listing Regulations) and Circular dated May 12, 2020 issued by Securities and Exchange Board of India ("SEBI Circular") to transact the business as set out in the Notice of the EGM. Members attending the EGM through VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act.

of reckoning the quorum under Section 103 of the Act.
In compliance with the above circulars, the EGM Notice has been electronically sent on Wednesday, 11th January, 2023 to those Members whose names appeared in the Register of Members / Register of Beneficial owners as on close of business hours on Friday, 6th January, 2023 and who have registered their email addresses with the Depository Participants or with the Registrar & Share Transfer Agent of the Company ("R&T Agent") or with the Company. The Notice of the EGM is also available on the Company; swebsite of stock exchange i.e. BSE Limited at www.bseindia.com and on website of e-voting facility provider i.e. National Securities Depository Limited ("NSDL") at www.evoting.nsdl.com.

Manner of updating e-mail address is a blow:

Members holding shares in Dematerialized mode, who have not registered/updated their email addresses with their Depository Participants, are requested to register/update their email addresses with their respective Depository Participants with whom they maintain their Demat Account.

a) The Company has provided the facility to the Members to cast their vote on the matters set forth in EGM Notice, either by way of "remote e-voting" facility, prior to the EGM or by way of electronic voting system during the EGM. The instructions for joining the EGM and the manner of participation and voting are provided in the Notice of the

EGM.
b) The manner of voting by the Members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email address, facility for voting shall be exercised through electronic means at EGM.
c) A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the Cut-off date i.e. Thursday, 26th January, 2023 only shall be entitled to avail the facility of remote e-voting or participation at the EGM and voting through electronic voting system thereat.
d) The remote e-voting will commence on Monday, 30th January, 2023 at 9:00 A.M. (IST) on and be concluded on Wednesday, 1st February, 2023 at 5:00 P.M. (IST).

on and be continued on inventesday, Ist rebruary, 2023 at 5:00 P.M. (IST).

e) Any Person, who acquires shares of the Company and becomes member of the Company after dispatch of notice of EGM and who holds Shares of the Company as of cut-off date i.e., 26th January, 2023, may obtain the login ID and password by sending a request at evoting@nscll.co.in. However, if holder is already registered with NSDL for remote e-voting then the use of existing user ID and password for casting the vote shall work.

f) E-voting shall not be allowed beyond Wednesday, 1st February, 2023 at 5:00 P.M.

(ISI).

g) Further the facility for voting through electronic voting system will also be made available during the EGM, to the Members who are attending the EGM and have not already cast their vote(s) through remote e-voting.

h) Members who have cast their vote by remote e-voting may also attend the EGM, but shall not be allowed to vote again at the EGM.

I) If any Member wishes to get a printed copy of the EGM notice, the Company shall send the same, free of cost, upon receipt of request from the Member.

the same, free of cost, upon receipt of request from the Member.

j) A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting;

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 18001020990 and 1800224430 or send a request at evoting@nsdl.co.in.

Members are requested to carefully read all the Notes set out in the Notice of the EGM and in particular, instructions for joining the EGM, manner of casting vote through remote e-voting or through electronic voting system during the EGM.

Manner of updating e-mail address is a blow:

Date: 10th January, 2023

contents of the publication remain unchanged.

nconvenience caused is highly regretted.

DELHI / GURGAON : SALE / RENT : **UDYOG VIHAR** PACE CITY

INFOCITY **IMT MANESAR** BAWAL

PLOT & BUILDING FOR SALE 1000, 4000 sq. mtr, 2 Acre, 5 Acre, 10 Acre **BUILDING FOR RENT** 25 000 to 50 000 Sq.ft. 100 000 to 200 000 Sq.ft. **LEASE FOR WAREHOUSE & LAND**

New Sheds - 200 000 to 500 000 Sq. ft .

SAYA ESTATE 9810235126

भारतीय कटेनर निगम शिसिटेड Container Corporation of India Ltd. Navratna Company (A Govt. of India Undertaking) Regd. Office & Investors Relation Centre: CONCOR Bhawan,

C-3, Mathura Road, New Delhi-110076.

LANCO SOLAR PRIVATE LIMITED -

IN LIQUIDATION

U74900TG2008PTC060157

E-AUCTION SALE NOTICE

Sale of Assets

The assets of Lanco Solar Private Limited - In Liquidation are

being put on sale through e-auction by the Liquidator

appointed by Hon'ble National Company Law Tribunal,

The e-auction will be conducted for 2 blocks which are

Block 1: 33.62 acres of Land Parcel at Pullanayakanpatti,

E-Auction on February 08, 2023, from 2 PM to 3 PM at web

Call at +91 88285 76197 or Email at lq.lspl@gmail.com for

more information. Detailed Sale notice uploaded on the

For Lanco Solar Private Limited - In Liquidation

આઇએમપી પાવર્સ લીમીટેડ

Authorisation for Assignment valid till December 23, 2023 huzefa.sitabkhan@gmail.com, lq.lspl@gmail.com

CIN : L31300DN1961PLC000232 રજીસ્ટર્ડ ઓફીસ : સર્વે નં. રફ3/3/૨/૨, ગામ–સાચલી, ઉમર ફુઇન રોડ, સિલવાસા (ચુ.ટી.)–૩૯૬ ૨૩૦, દાદરા અને નગર હવેલી, સિલવાસા–૩૯૬૨૩૦

છઠ્ઠી વાર્ષિક સામાન્ય બેઠક અને

ઈ–વોટીંગ માહિતીની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે ૧૦ જાન્યુઆરી, ૨૦૨૩ ની તારીખની નોટીસમાં દર્શાવેલા વ્યવસાયન વ્યવહારો કરવા આઇએમપી પાવર્સ લિમિટેડ (કંપની) ના સભ્યોની છક્કી વાર્ષિક સામાન્ય બેઠક (એજીએમ)

સમાન સ્થળે સભ્યોની પ્રત્યક્ષ હાજરી વિના વીડિયો કોન્કરન્સીંગ (વીસી) અન્ય ક્રચ્ય-શ્રાવ્ય માધ્યમ (ઓએવીએમ) મારકતે ગુરૂવાર, ૦૨ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજબપોરે ૨.૦૦ (ભારતીય સમય) કલાકે કરવામ

૧૩મે, ૨૦૨૨, ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ અને ૧૨ મે, ૨૦૨૦ની તારીખના સેબી પરિપત્રો સાથે વંચાતા કોર્પોરે

બાબતોના મંત્રાલય દારા આપવામાં આવેલા ૦૫ મે. ૨૦૨૨ ની તારીખના સામાન્ય પરિપત્ર નં. ૦૨/૨૦૨૨ અને ૧૪

ગાળાાાના નગાવાલ દ્વારા આવવાના આવારાખ ન ૧૯૨૬ આ વારા છે. ઉક્તેમ્બર, ૨૦૨૧, ૦૮ ક્રિસેમ્બર, ૨૦૨૧, ૧૩૧૪નથુઆરી, ૨૦૨૧, ૦૮ એપ્રિલ, ૨૦૨૦, ૧૩ એપ્રિલ, ૨૦૨૦ અને ૧ મે, ૨૦૨૦ ની તારીખના અનુક્રમે સામાન્ય પરિપત્ર નં. ૨૧/૨૦૨૧, ૧૯/૨૦૨૧, ૦૮/૨૦૨૧, ૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૨

અને ૨૦/૨૦૨૦ સાથે લંચાર્તી કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની લાગુ પડતી તમામ જોગવાઈઓ અને તેમની હેઠળ બનાવેલાનિચમોનાઅનુપાલનમાં કંપનીએ જેમના ઈમેઈલ આઈડી ડિપોઝીટરી સહભાગી(ઓ)/કંપની/કંપનીના

રજાસ્ટાર અને શેર ટાન્સ કર એજન્ટ (આરટીએ). લિંક ઈનટાઈમ ઈન્ડિયા પાઈવેટ લિમિટેડ પાસે નોંધાયેલા છે

મને ૨૦૨૧–૨૨ ના વાર્ષિક અહેવાલની સાથેની નોટીસ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ ઈલેક્ટ્રોનિક મોડમ

એજીએમની નોટીસ સાથેનો કંપનીનો ના.વ. ૨૦૨૧–૨૨ નો વાર્ષિક અહેવાલ અને ઈ–વોટીંગ સચનાઓ કંપનીર્ન odoratis (www.imp-powers.com), સ્ટોક એક્સરેન્જ એટલે કે બોએસાં (લિમેટેડ (www.bseindia.com) અને નેશનલ સ્ટોક એક્સરેન્જ ઓફ ઇન્ડિયા (www.nseindia.com)પર અને

નેશનલ સિક્ચોરીટીઝ ડિપોઝીટરી લિમિટેડ (એનએલડીએલ) ની વેબસાઈટ (www.evoting.nsdl.com

કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિચમો, ૨૦૧૪ ના નિચમ ૨૦ અને લિસ્ટીંગ રેગ્યુલેશન્સન

ટેગ્યુલેશન ૪૪ સાથે વંચાતી કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ ની જોગવાઈઓ અનુસાર, એજીએમ ખાતે

વ્યવસાયના તમામ વ્યવહારો કરવાના સંબંધમાં કંપની એનએસડીએલની ઇ-વોટીંગ સેવાઓ મારફતે તેન

સભ્યોના મતદાન અધિકારો ગુરૂવાર, રદ્દ જાન્યુઆરી, ૨૦૨૩ (કટ–ઓફ તારીખ) મુજબ કંપનીની ચુકવાદ ગયેલી ઇક્વીટી શેર મૂડીમાં તેમના હિસ્સાના પ્રમાણમાં રહેશે. કોઇપણ વ્યક્તિ, જેમના નામ કટ–ઓફ તારીખે

સભ્યોના રજ઼સ્ટરમાં અથવા ડિપોઝીટરીઓ/આરટીએ દ્વારા જળવાચેલા લાભાર્થી માલિકોના રજ઼સ્ટરમ

સાન્યાના કાંગ્રેટ્ટરના અથવા કાંગ્રેગ્ટાટાઓ આવારા કરો છે. નોંધારોલા હવે માત્ર તેઓ જ રિમોટ ઇ-તોર્ટીંગ મારફતે 'આચારા એશુએમ ખાતે તેમનો મત આપવાના હકદા; રહેશે. કોઇપણ વ્યક્તિ જે કંપની શેરો ધરાવે છે અને એશુએમની નોટીસની રવાનગી પછી કંપનીના સભ્ય બન્ય

છે અને કટ-ઓફ તારીખ મુજબ શેરો ધરાવે છે, તેઓ તેમનો મત આપવા અને એજીએમમાં ઉપસ્થિત રહેવા માટે એજીએમની નોટીસમાં અપાયેલી સુચનાઓને અનુસરી શકે છે.

રામુંદાના સારાતા ભાવતા મુંચાયાતા અનુમાં સાથે છે. દિમોટ ઇ-વોર્ટીંગ સમચગાળો સોમવાર ૩૦ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ સવારે ૯.૦૦ કલાકે શરૂ થશે અને બુધવાર ૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજસાંજે૫.૦૦ કલાકે સમાપ્ત થશે. આ સમચગાળા દરમિયાન, સભ્યો EVEN 123196 પસંદ કરીને ઇલેક્ટ્રોનિક રીતે તેમનો મત આપી શકે છે. એનએસડીએલ દ્વારા રિમોટ ઇ-વોર્ટીંગ બુધવાર ૦૧

. ઈલેક્ટ્રોનિક માધ્યમો મારફતે મત આપવાની સુવિધા એજીએમ ખાતે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે સભ્યો

જે વીસી/ઓએવીએમ મારકતે એજાએમમાં ઉપસ્થિત હોચ અને જેમણે ઠરાવો ઉપર રિમોટ ઇ–વોટીંગ દ્વારા તેમન મત ન આપણા લિયા ત્રાસ્ત્ર તારણ ઇત્સાગનના ઉપાદવાદા હોય છો જ માન હારાયા ઉપાદ વાયદ છે – પાદાગ ફુંદર દામને મત ન આપણા હોય તેઓ એગ્રુએમ દરમિયાન ઇ-વોર્ટીંગ મારફતે તેમનો મત આપણા માટે પાત્ર રહેલે, સન્યો જેમણે એગ્રુએમ અગાઉ રિમોટ ઇ–વોર્ટીંગ દ્વારા તેમના મત આપી દીધા હોય, તેઓ વીરી/ઓએવીએમ મારફતે

એજીએમમાં ઉપસ્થિત રહી શકશે પરતું. તેઓ એજીએમમાં કરીથી તેમનો મત આપવા હકદાર રહેશે નહીં એજીએમમાં ઉપસ્થિત રહેવાની એનએસડીએલની ઇ–વોટીંગ પ્રણાલી નો ઉપયોગ કરીને મત આપવાની પ્રક્રિય

ાંપનીના સભ્યો જેમણે તેમના ઈ–મેઇલ એડ્રેસ નોંધાવ્યા નથી તેઓ તેને નીચે જણાવેલી પ્રક્રિયાનું અનુસર

દ્વારા સહી કરેલા આઇએસઆર–૧ ફોર્મ પૂરા પાડીને કંપની ના આરટીએ પાસે તેમના ઇ–મેઇલ એડ્રેસ નોંધાર્વ

જોકે, ના.વ. ૨૦૨૧–૨૨ ના વાર્ષિક અહેવાલ અને દુહી એજીએમની નોટીસની સોફ્ટ કોપી મેળવવા, એવા સભ્યે

શેરધારકનું નામ, ડીપીઆઈડી/ક્લાયન્ટ આઈડી, પાન અને મોબાઈલ નંબર જેવી તેમની વિગતો ઇમેઈલ દ્વાર

રિમોટ ઇ-વોટીંગ અથવા એજીએમ ખાતે ઇ–વોટીંગ સંબંધિત ઇ–વોટીંગને લગતી કોઇપણ પૂછપરછ માટે, સભ્યં

એનએસડીએલ ને evoting@nsdl.co.in/qcooqooece અને qcooqooso ઉપર evoting@nsdl.co.in ખાતે એનએસડીએલનો સંપર્ક કરી શકે છે અથવા

https://www.evoting@nsdl.co.inઉપ૨ ડાઉનલોડ સેક્શનમાં શેરદ્યા૨કો માટે ઉપલબ્દા ફિક્વન્ટલી

આઈએમપી પાવર્સ લિમિટેડ માટે

3 Positions (1 OBC-NCL.

2 UR) (Out of 3 positions

1 position is reserved

મુકેશ વર્મા રેઝોલ્યુશન પ્રોફેશનલ

આસ્કડ ક્વેશ્ન્સ (એફએક્યુ) સેક્શન/ઇ–વોટીંગ યુઝર મેન્યુઅલનો સંદર્ભ લઈ શકે છે.

તેમજ એજીએમમાં ઇ–વોટીંગથી તેમનો મત આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવીને સંતુષ્ટ છે.

કેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ સાંજે ૫.૦૦ કલાક પછી બંધ કરવામાં આવશે.

અને પધ્ધતિ એજાએમની નોટીસમાં આપવામાં આવી છે.

કરીને તેમના ઈ-મેઈલ એડ્રેસ નોંધાવી શકે છે.

cs@imp-powers.com ને મોકલી શકે છે.

વેબસાઇટ : www.imp-powers.com, ઇમેઇલ : cs@imp-po

Huzefa Fakhri Sitabkhan, Liquidator IBBI/IPA-001/IP-P00031/2017-18/10115

Block 2: Investment in Wholly Owned Subsidiary

portal of: https://ncltauction.auctiontiger.net

website: https://ncltauction.auctiontiger.net



MSTC/VAD/M STC /22-23/32630 Limited/5/Guiarat વધુ વિગતો અને ૨જીસ્ટ્રેશન માટે www.mstcecommerce.com અથવા www.mstcindia.co.in ની મુલાકાત

સંਪર્ક: marutsaha@mstcindia.co.in/ rksingh@mstcindia.co.in มโดเยต નં.: ૮૪૨૦૧૭૮૨૮૩ /૮૩૩૬૯૨૮૫૪૮. ઇ-હરાજીમાં સુધારો/ વધારો/ શુદ્ધિપત્ર/ સમચમાં લંબાણ/સ્પષ્ટતાઓ, જો કોઇ હોચ તો, ફક્ત એમએસટીસીની વેબસાઇટ પર જાતને માહીતગાર રાખવા માટે નિયમિત

(ભારત સરકારનું ઉપક્રમ) CIN : L27320WB1964GOI026211 પ્લોટ નં. સીએફ–18/2, રોડ નં. 175, એક્શન્ એરિયા 1સી, ન્યુ ટાઉન, કોલકતા–700156 કોકિંગ કોલનું ઇ–હરાજી વેચાણ

સાઇટ પર આવેલ કોકિંગ કોલના વેચાણ માટે ૩૦.૦૧.૨૦૨૩ ના રોજ ઈ–હરાજી નં.

લેવી. જ મુકવામાં આવશે. બીડરોએ પોતાની રીતે ઉપરોક્ત વેબસાઇટની મુલાકાત લેવી

જાહેર નોટીસ

એસ્ટી એડવાઇઝર્સ પ્રાઇવેટ લીમીટેડ (જુની કંપની અથવા મર્જડ કંપની), PAN AABCE9657R, PMS License INP000003146

એસ્ટી એડવાઇઝર્સ લીમીટેડ (જુની એસ્ટી ફિનકેપ પ્રાઇવેટ લીમીટેડ "રીઝલ્ટીંગ કંપની")PANAAAFCE5637D,PMS License INP000007720 ટ્રઝસ્ટર્ડ ઓફીસ: પીઓપ-૦૧એ,પીઓપ-૦૧બી,પીઓપ-૦૧સી,પાંચમો માળ, ટાવર-એ, ડબલ્યુટીસી ગીફ્ટ સીટી, બ્લોક ૫૧, રોડ ૫ઇ, ઝોન–૫ ગીફ્ટ સીટી, ગાંધીનગર, ગુજરાત–૩૮૨૩૫૫.

કોર્પોરેટ ઓફીસ: ૮મો માળ, બ્લોક આઇ, વાટિકા બિઝનેશ પાર્ક, સોહના રોડ, સેક્ટર ૪૯, ગુરૂગ્રામ, હરિયાણા-૧૨૨૦૦૧ા સંપર્ક નં. +૯૧ ૧૨૪ ૪૬૩૭૭૦૦, ફેક્સ: +૯૧ ૧૨૪ ชรุ30901 นัดเลเยอ : www.esteeadvisors.com આઇડી vestorsgrievances@esteeadvisors.cor

અમાલ્ગમેશન અન્વચે પીએમસી પ્રવૃતિઓની INP000003146 માંથી INP00007720 માં ફેરબદલી આથી જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે જુની કંપની એસ્ટી એડવાઇઝર્સ પ્રાઇવેટ લીમીટેડ PAN AABCE9657R, PMS License INP000003146 એસ્ટી એડવાઇઝર્સ પ્રાઇવેટ લીમીટેડ (જુની એસ્ટી પિનકેપ પ્રાઇવેટ લીમીટેડ) PAN AAAFCE5637D. PMS License INP000007720 સાથે એનસીએલટી આદેશ તારીખ 3 મે ૦૨૧ મુજબ અમાલ્ગમેટેડ કરાઇ હતી. અમાલ્ગમેશનને જોતાં જુની કંપનીની તમામ એસેટો, જ્વાબદારીઓ, રજીસ્ટ્રેશનો, લાચસન્સો, એગ્રીમેન્ટો, કરારો, રીલેશનશીપ અને કર્મચારીઓને રીઝલ્ટ કંપનીમાં તબદીલ કરાચેલ છે જેમાં પીએમસએસ ૨જીસ્ટ્રેશન, તેની જવાબદારીઓ મેન્ડેટ્સ, ક્લાઇન્ટો વગેરેનો પણ સમાવેશ થાય છે પરંતુ તે પુરતા મર્ચાદિત નથી.

નોંધ લેવી કે ક્લાઇન્ટ માટે તમામ ભાવી પીએમએસ પ્રવૃતિઓ રીઝલ્ટ કંનપી એસ્ટી એડવાઇઝર્સ પ્રાઇવેટ લીમીટે.ડ (જુની એસ્ટી ફિનકેપ પ્રાઇવેટ લીમીટેડ) PAN AAAFCE5637D, PMS License INP000007720 દ્વારા સંભાળવામાં આવશે. જો કોઇપણને કરિયાદ હોય તો, તેઓ scores.gov.in ઉપર તેમની ફરિયાદ નોંધાવી શકે છે. એસ્ટી એડવાઇઝર્સ પ્રાઇવેટ લીમીટેડ વતી

ઉમેશ કુમાર (ડાચરેક્ટર) (ડીઆઇએન: ૦૧૧૧૧૦૮૨)

PREMIER POLYFILM LTD.

Regd. Office: 305, III Floor, Elite House, 36, Community Centre, Kailash Colony Extn., Zamroodpur, New Delhi -110048. CIN: L25209DL1992PLC049590, Phone : 011-29246481
Email: compliance.officer@premierpoly.com Website: www.premierpoly.com

NOTICE

Notice is hereby given that pursuant to Regulation 29 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations.2015, a Meeting of Board of Directors of the company will be held on Friday, 27h January,2023 at 11.30 A.M. at Registered Office of the company at 305, III Floor, Elite House, 36, Community Centre, Kailash Colony Extension. Zamroodpur. New Delhi 110048 to consider and approve Unaudited Standalone Financial Results of the company for the quarter and nine months ended 31st December,2022.

Further, trading window for dealing in the securities of the Company by the Insiders, as defined under the SEBI (Prohibition of Insider Trading) Regulations,2015 is closed from Sunday, 01st January,2023 to Sunday, 29th January,2023 (both days inclusive).

The notice is available on the Company's website www. premierpoly.com and also on www.bseindia.com and www.nseindia.com

For PREMIER POLYFILM LTD

Place: New Delhi

Date: 11.01.2023 **COMPANY SECRETARY & COMPLIANCE OFFICER**



THE TATA POWER COMPANY LIMITED

Registered Office: Bombay House, 24, Homi Mody Street, Mumbai 400 001, Tel: 91 22 6665 8282 CIN: L28920MH1919PLC000567 Email: tatapower@tatapower.com Website: www.tatapower.com

NOTICE OF RECORD DATE

NOTICE is hereby given pursuant to Section 91 of the Companies Act, 2013 that Sunday, 5th February 2023 has been fixed as the Record Date for the purpose of

Annual interest on the 2500 - 9% Unsecured, Redeemable, Taxable, Listed, Rated Non-Convertible Debentures (INE245A08141) aggregating a cumulative face value of ₹10,00,000 and 7500 - 8.84% Unsecured, Redeemable, Taxable, Listed, Rated Non-Convertible Debentures (INE245A08166) aggregating a cumulative face value of ₹10,00,000 and

The redemption proceeds of the separately transferable redeemable principal of 8.84% Unsecured, Redeemable, Taxable, Listed, Rated Non-Convertible Debentures, aggregating ₹750,00,00,000,

both due on 21st February 2023.

For The Tata Power Company Limited

Place: Mumbai Date: 11th January 2023

H. M. Mistry **Company Secretary**

ગૌરીસુતા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

ફોર્મ નં.: INC - 25A

ના કન્વર્સન માટે અખબારમાં જાહેરખબર પ્રસિદ્ધ કરાવી રહ્યાં છીએ પબ્લિક લિમિટેડ કંપનીમાંથી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલયના પ્રાદેશિક નિયામક સમક્ષ ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની બાબતમાં, કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૪ અને કંપનીઝ (ઈન્કોર્પોરેશન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૪૧

ગોરીસુતા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના મામલે કંપની એક્ટ, ૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ કેંપની, જેની રજીસ્ટર્ડ ઓફિસ એ-૬૦૨, ટાઇટેનિયમ સિટી સેન્ટર, સચિન ટાવર્સ પાસે, ૧૦૦ ફીટ રિંગ રોડ, આનંદનગર, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫.

અરજદાર

સામાન્ય જનતાને સૂચના આપવામાં આવે છે કે કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૪ હેઠળ કેન્દ્ર સરકારને અરજી કરવા ઈચ્છતી કંપની ઉપરોક્ત નિયમો સાથે વાંચે છે અને ખાસ ઠરાવના સંદર્ભમાં પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં કન્વર્સન કરવા ઈચ્છુક છે. ૧૧મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ આયોજિત અસાધારણ સામાન્ય સભા કંપનીને આવા કન્વર્સનની અસર આપવા સક્ષમ બનાવેલ છે.

કોઈપણ વ્યક્તિ કે જેના હિતને કંપનીના સુચિત ફેરફાર સ્થિતિથી અસર થવાની સંભાવના છે તે તેના હિતની પ્રકૃતિ અને સંબંધિત ક્ષેત્રના વિરોધનું કારણ જણાવતા તેના પ્રાદેશિક નિયામક, ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર, આરઓસી ભવન, સામે રૂપલ પાર્ક સોસાયટી, અંકુર બસ સ્ટોપની પાછળ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩, આ નોટિસના પ્રકાશનની તારીખથી ચૌદ દિવસની અંદર અરજદાર કંપનીને તેની રિજસ્ટર્ડ ઓફિસમાં નીચે દર્શાવેલ સરનામે એક નકલ સાથે વાંધાઓ ની નકલ સોગંદનામાં હોરા સમર્થિત રજિસ્ટર્ડ પોસ્ટ હોરા અથવા તો જાતે જઈને નીચે જણાવેલ

રજીસ્ટર્ડ ઓફિસ : એ-૬૦૨, ટાઈટેનિયમ સિટી સેન્ટર, સચિન ટાવર્સ પાસે, ૧૦૦ ફીટ રિંગ રોડ, આનંદનગર, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫

તારીખ : ૧૧મી જાન્યુઆરી ૨૦૨૩ સ્થળ : અમદાવાદ

Sla : 09226072 સ્ટેસ્ડ એસેટસ રીકવરી બ્રાંચ (એસએઆરબી)

ભંડારી રવિ

મેનેજાંગ ડિરેક્ટર

અરજદાર માટે અને તેના વતી



૧લો માળ, રત્ના આર્ટેમસ, ૪૨, સરદાર પટેલ નગર, ગીરીશ કોલ્ડ્રીક્સ ચાર રસ્તા પાસે, સમુદ્ર એનેક્ષ પાસે ઓફ. સી. જી. રોડ, એલીસબ્રીજ, અમદાવાદ



કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

આથી, નીચે સહી કરનારે ભારતીય સ્ટેટ બેંકના અધિકૃત અધિકારી તરીકે સિક્ચોરીટાઈઝેશન

मेन्ड रिङन्स्ट्रङ्शन ओङ् झर्धनान्सियत એसेट्स એन्ड ॲन्झेर्समेन्ट ओङ् सिड्योरीटी र्घन्टरेस એક્ટ. ૨૦૦૨ અને સિક્યોરીટી ઈન્ટરેસ્ટ(એન્કોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ના નિયમ 3 સાથે વંચાર્ત કલમ ૧૩(૧૨) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને **૨૨/૦૪/૨૦૨૧ની તારીખની** ડિમાન્ડ નોટીર જારી કરીને દેવાદાર **મે. રૂદ્રશિવા ઇન્ફાકોન પ્રાઈવેટ લિમિટેડ (હવે નામદાર એનસીએલર્ટ** અમદાવાદના ૨૦૧૯ ના સીપી(આઈબી) ૪૫૩ માં પાન્ડા વોટર ટેક પ્રા. લિ. વિરૂદ્ધ રૂદ્રશિવા ઈન્ફાકોલ પ્રા. લિ. ની ભાભતમાં ૩૧/૦૫/૨૦૨૨ ની તારીખના આદેશની શરતો અંતર્ગત સીઆઇઆરપી હેઠળ), શ્રી આશિષ કુમાર ગોચલ (ગીરવેદાર/જામીનદાર), શ્રી પિનાકીનકુમાર ભરતભાઇ સોર્ન નદાર), શ્રી કુલેદિપ મનોરભાઈ ઢોલું (ગીરવેદાર/જામીનદાર) અને શ્રી ઉપેન્દ્ર કે. પા<mark>નેસરા (ગીરવેદાર/બમીનદાર)ને</mark> કલમ ૧૩(૨) હેઠળની ડિમાન્ડ નોટીસમાં દશવિલી **તા.** ૨૧/૦૪/૨૦૨૧ મુજબની રૂા. ૩,૩૯,૭૯,૩૯૧/- (રૂપિયા ત્રણ કરોડ ઓગણચાલીસ લાખ સિત્યોત્તેર **હજાર ત્રણસો એકાણું પુરા)** તરીકેની રકમ અને ઉપાર્જિત વ્યાજ અને પડતર વગેરે કથિત નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર પરત ચુકવવા જણાવ્યું હતું. દેવાદાર/જમીનદારો/ગીરવેદારો રકમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી ,

જામીનદારો/ગીરવેદારો અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારે કથિત નિયમોના નિયમ ૮ સાથે વંચાતી કથિત એક્ટની ક્લમ ૧૩(૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાની રૂએ અહીં નીચે વર્ણવેલી મિલક્તનો **પ્રત્યક્ષ કબજો ૮મી જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ લઈ લીધો છે.** આથી જાહેર જનતા અને ખાસ કરીને જામીનદારો/ગીરવેદારો ને ચેતવણી આપવામાં આવે છે કે મેલકત સાથે કોઈપણ વ્યવહાર કરવો નહી અને મિલકત સાથે કરાયેલા કોઈપણ વ્યવહારન ચાર્જ ભારતીય સ્ટેટ બેંકની **તા. ૨૧/૦૪/૨૦૨૧ મુજબની બાકી રૂા. ૩,૩૯,७७,૩૯૧/- (રૂપિયા ત્રણ કરોડ ઓગણચાલીસ લાખ સિત્યોત્તેર હજાર ત્રણસો એકાણું પુરા)** ૨કમ અને ચૂક્ તારીખ સુધીના તેની પરના આગળના વ્યાજ અને આકસ્મિક ખર્ચાઓ, પડતરો, ચાર્જિસ વગેરે

ઉપલબ્ધ સમયમાં સિક્યોર્ડ મિલકતો છોડાવવા અંગે સરફેસી એક્ટની કલમ ૧૩ની પેટા-કલ (૮)ની જોગવાઈઓ પ્રત્યે જામીનદારો/ગીરવેદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

स्थावर भिलङतनुं वर्णन

શ્રી આશિષ કુમાર ગોચલના નામે મોજે ઘુમા, તાલુકા દસક્રોઈ, રજીસ્ટ્રેશન જીલ્લા અને ઉપ જીલ્લા અમદાવાદ-૯ (બોપલ) ખાતે સ્થિત ઘુમા ગ્રામ પંચાયતના ગામતળ વાડાના વાડા પત્રક મિલકત નં. ૧૨ અને ૧૮ ખાતે સ્થિત એન.ડી.-૨ **રે**સિડેન્સી કોમ્પલેક્ષ તરીકે જાણીતી બિલ્ડીંગના બીજા માળે આશરે ૮૦ ચોરસ વાર સુપર બિલ્ટ અપ એરિયા માપના ફ્લેટ નં. ૨૦૨ (ફ્લેટ નં. બી-૨૦૨) ભાગ-૨ તરીકેની સ્થાવ૨ મિલક્તના તે તમામ પીસ અને પાર્સલ . **ચર્તુસીમાઃ ઉત્તરેઃ** ફ્લેટ નં . બી-૨૦૫ , **દક્ષિણેઃ** ક્લશ ટેસિડેન્સી, **પૂર્વેઃ** ફ્લેટ નં. બી-૨૦૫, **પશ્ચિમેઃ** ફ્લેટ નં. બી-૨૦૧

તારીખ : ૦૮.૦૧.૨૦૨૩ આગારમભ : ભાજ

ફાયનાન્સિયલ એક્સપ્રેસ

PUBLIC NOTICE

Notice is hereby given that shareholders for undermentione equity shares of Goldline International Finvest Limited have not received the new share certificates at face value of Rs. 1/- each. Therefore, holder of said equity shares applied for issue duplicate share certificates. Any persor who has claim in respect of said shares should lodge the same with the company at its registered office else the company will proceed to issue duplicate certificate to aforesaid applicant without any further information.

Folio No. Name of Shareholder No of shares Face Value Distinctive no. Certificate No. 2177 Hemant Ramswaroop Agrawal 100000 Rs. 10/- 28603001 to 28703000 35102

Sd/- Mr. Hemant R. Agrawal

PUBLIC NOTICE

Notice is hereby given that shareholders for undermentioned equity shares of Goldline International Finvest Limited have not received the new share certificates at face value of Rs. 1/- each. Therefore, holder of said equity shares applied for issue duplicate share certificates. Any person who has claim in respect of said shares should lodge the same with the company a its registered office else the company will proceed to issue duplicate certificate to aforesaid applicant without any further information.

Folio No.	Name of Shareholder	No of shares	Face Value	Distinctive no.	Certificate No.
2176	Basant Ramswaroop Agrawal	100000	Rs. 10/-	28503001 to 28603000	35101
2181	Sangita Basant Agrawal	100000	Rs. 10/-	29003001 to 29103000	35106
	100 NO.	***************************************	Sd/- M	r. Basant R.	Agrawal

Mrs. Sangita Basant Agrawal

DEBTS RECOVERY TRIBUNAL-II

(Government of India, Ministry of Finance 3rd Floor, Bhikhubhai Chamber, Near Kochrab Ashram,

Paldi, AHMEDABAD-380006.

FORM NO. 14 (See Regulation 33(2))

RP/RC No. 70/2022 O.A. 264/2017 Axis Bank Ltd. **Certificate Holder Bank**

VERSUS M/s. Radheshyam Oil Industries & Ors. Certificate Debtors

DEMAND NOTICE

C.D.No.1: M/s. Radheshyam Oil Industries, A Partnership Concern of Defendant No.2 having its office at: Opp. Jamwadi Petrol Pump, N.H.8B, Jamvadi, Taluka Gondal-360311 Dist. Raikot.

C.D.No.2: Mr. Kacharabhai Ranchhodbhai Panchani (Vaishnave), Proprietor of Defendant No.1 and also in capacity as mortgagor as well as personal capacity as guarantor, Residing at: Plot No.13/P, Sanjay Society, Jetpur Road, Gondal, Rajkot-360311 C.D.No.3: Mr. Tulsibhai Ranchhodbhai Panchani (Vaishnave), In a capacity as mortgagor

as well as Personal capacity as Guarantor Residing at: Nikunj Sanjay Society, Plot No.31/A/P, Jetpur Road, Gondal, Rajkot - 360001 C.D.No.4: Ms. Vilasben Kishorbhai Panchani, In capacity as Mortgagor as well as

Personal capacity as guarantor residing at: 'Prem Prabhu', Green Park, Jetpur Road, Gondal,

In view of the Recovery Certificate issued in O.A. No.264/2017 passed by the Hon'ble Presiding Officer, Debts Recovery Tribunal-II, Ahmedabad, an amount of Rs.3,59,18,856.00 (Rupees Three Crore Fifty Nine Lacs Eighteen Thousand Eight **Hundred Fifty Six Only)** including interest as on 02/11/2020 and further interest from 03/11/2020 plus cost of Rs.1,75,000.00 is due against you. (Less recovery, if any).

You are hereby called upon to deposit the above sum within 15 days of the $receipt of the \ notice, failing \ which \ the \ recovery \ shall \ be \ made \ as \ per \ rules.$ In additions to the sum aforesaid you will be liable to pay:

(a) Such interest and cost as in payable in terms of Recovery Certificate (b) All costs, charges and expenses incurred in respect of the service of this notice and other process that may be taken for recovering the amount due

Given under my hand and the seal of the Tribunal, this 19/12/2022 Next Date : 27/01/2023.



(Prakash Meena) Recovery Officer-II Debts Recovery Tribunal-II, Ahmedabad



Dhiraj Kothari (Whole-time Director

(Formerly Larsen & Toubro Infotech Limited) CIN: L72900MH1996PLC104693

Registered Office: L&T House, Ballard Estate, Mumbai - 400 001, India Corporate Office: Technology Tower 1, Gate No. 5, Saki Vihar Road, Powai, Mumbai-400 072, India. Tel: +91 22 6776 6776, Fax: +91 22 4313 0997 E-mail: investor@ltimindtree.com; Website: www.ltimindtree.com

NOTICE TO MEMBERS

Members are hereby informed that pursuant to Section 108 and Section 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 ("the Act"), read with Rule 20 and Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014 and General Circular No. 11/2022 dated December 28, 2022 (in continuation to the circulars issued earlier in this regard) issued by the Ministry of Corporate Affairs ("MCA Circular"), applicable provisions of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"), the Company has on Wednesday, January 11, 2023, sent a Notice of Postal Ballot dated January 11, 2023, together with the Statement pursuant to Section 102(1) of the Act, via e-mail to all the members of the Company along with the login ID and password to the Members for e-voting, who have registered their email address with the Company/ Depositories/Depository Participants/ Company's Registrar and Share Transfer Agent viz. Link Intime India Private Limited, to seek their approval through remote e-voting only, for:

- 1. Appointment of Mr. Debashis Chatterjee (DIN: 00823966), director not liable to retire by rotation, as Chief Executive Officer & Managing Director;
- 2. Appointment of Mr. Venugopal Lambu (DIN: 08840898), director liable to retire by rotation, as Whole-Time Director;
- 3. Appointment of Ms. Apurva Purohit (DIN: 00190097) as Independent Director; 4. Appointment of Mr. Bijou Kurien (DIN: 01802995) as Independent Director;
- 5. Appointment of Mr. Chandrasekaran Ramakrishnan (DIN: 00580842) as
- Independent Director: and 6. Modification in remuneration of Mr. Nachiket Deshpande (DIN: 08385028) as

The Notice of Postal Ballot is available on the Company's website at: https://www.ltimindtree.com/investors/, on website of National Securities Depository Limited ('NSDL') at: https://evoting.nsdl.com/ and on the website of the stock exchanges i.e. BSE Limited ('BSE') at: https://www.bseindia.com/ and the

National Stock Exchange of India Limited ('NSE') at: https://www.nseindia.com/ n compliance with the applicable provisions of the Act and MCA Circular, the Company has sent the aforementioned Notice of Postal Ballot to those Members who hold equity shares of the Company as on Friday, January 6, 2023 ("Cut-off date"). A person who is not a member as on the Cut-off date should treat the Notice for information purpose only. Members may please refer to the voting instructions outlined in the Notice of Postal Ballot to cast their vote on the resolution(s) proposed for their approval in the Notice of Postal Ballot. The Company has engaged NSDL for providing e-voting facility to the Members of the Company to cast their vote electronically. Only those members whose name are recorded in the Register of Members of the Company or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the Cut-off date, will be entitled to cast their vote by remote

Voting rights of the Members shall be in proportion to their shareholding to the total paid-up equity share capital of the Company as on Cut-off date i.e. **Friday, January** The e-voting period shall commence on Thursday, January 12, 2023 at 9:00 a.m.

(IST) (Server Time) and shall end on Friday, February 10, 2023 at 5:00 p.m. (IST) (Server Time). Thereafter, the e-voting module shall be disabled by NSDL and Members will not be allowed to vote thereafter. Members whose e-mail ID is not registered and who wish to cast their vote, may

refer the procedure outlined in the Notes to the Notice of Postal Ballot Members who have not registered/updated their e-mail ID are requested to

register/update the same in the records of the Company/Depository, as the case may be, in the following manner: Members holding shares E-mail ID can be updated through their respective

in Demat Form Members holding shares in Physical Form

Whole-Time Director

Depository Participant E-mail ID can be updated through the Company's RTAi.e. Link Intime India Private Limited

The Company has appointed Mr. Ashish O. Lalpuria, Practicing Company Secretary (FCS No.: 9381 & C.P. No.: 11155) as the Scrutinizer for conducting the Postal Ballot process, in a fair and transparent manner. The results of the Postal Ballot will be announced on or before Sunday

February 12, 2023 and will be hosted on the Company's website at: https://www.ltimindtree.com/investors/, on website of NSDL at: https://evoting.nsdl.com/, displayed on the Notice Board of the Company at the Registered Office and Corporate Office, and will be simultaneously forwarded to the Stock Exchanges i.e. BSE Limited and the National Stock Exchange of India In case of any query, members may refer to the Frequently Asked Questions (FAQs)

for Shareholders and e-voting user manual for Shareholders available under the download section of https://www.evoting.nsdl.com/ or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or send a request to Mr. Anubhav Saxena at For **LTIMINDTREE LIMITED**

(Tridib Barat) Company Secretary and Compliance Officer

torrent CIN: L31200GJ2004PLC044068

વેબસાઈટ : www.torrentpower.com

રિજ. ઓફિસઃ "સમન્વય તપોવન, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫ (ગુજરાત) ભારત डोन: +८१ - ७८-२६६२८३०० ઈ-મેલઃ cs@torrentpower.com

ટોરેન્ટ પાવર લિમિટેડ

नोटिस

(સંપનીના ઈક્વિટી શેરધારકોને જાણ અને તાત્કાલિક કાર્ચવાહી માટે)

આથી નોટિસ આપવામાં આવે છે કે કંપનીઝ એક્ટ ૨૦૧૩ ની કલમ ૧૨૪ (૬) સાથે વંચાણે લેતા, ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (એકાઉન્ટિંગ, ઓડિટ, ટ્રાન્સફર એન્ડ રીફંડ) રૂલ્સ, ૨૦૧૬ (તેમજ સમયાંતરે તેમાં થયેલા સુધારા મુજબ), કંપનીના ઈક્વિટી શેર્સ કે જેનુ ડિવિડન્ડ સતત સાત વર્ષ અથવા તેથી વધુના સમયગાળા માટે શેરધારકો દ્વારા ક્લેઈમ થયુ નથી, તે ઈક્વીટી शेर्सने ઈन्वेंस्टर એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ("આઈઈપીએફ") ઓથોરિટીના ડિમેટ એકાઉન્ટમાં ફરિયાત પણે ટ્રાન્સફર કરવામાં આવશે.

જે શેરધારકોના શેર ઉપરોક્ત રૂલ્સ અનુસાર આઇઇપીએફમાં તબદીલ કરવા જરૂરી છે, તેમને કંપની દ્વારા વ્યક્તિગત સંદેશાવ્યવહાર કરવામાં આવેલ છે. કંપનીએ સંબંધિત શેરધારકોની સંપૂર્ણ વિગતો તેની વેબસાઈટ www.torrentpower.com પર ઉપલબ્ધ કરેલ છે.

સંબંધિત શેરધારકો, ફિઝીકલ સ્વરૂપે શેર ધારણ કરતા હોય અને જેમના શેર્સ આઇઇપીએફના ડિમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા જરૂરી છે, તેમને જણાવવાનું કે કંપની દ્વારા અસલ શેર સર્ટિફિકેટ કે જે શેરધારકો પાસે છે, તેના બદલામાં નવા શેર સર્ટિફિકેટ જારી કરવામાં આવશે અને ઓરિજીનલ શેર સર્ટિફિકેટ જેમના નામે છે એ શેર સર્ટિફિકેટ સ્વયં કેન્સલ થઇ અને તે રદ્દળાતલ માની લેવામાં આવશે. આઇઇપીએફના ડિમેટ એકાઉન્ટમાં શેર્સ ટ્રાન્સફર કરવા માટે કંપની કોર્પોરેટ એકશનના માધ્યમથી નવા શેર સર્ટિફિકેટ ને ડિમેટમાં કરવા માટે ડિપોઝિટરીને જાણ કરશે. એવા શેરધારકો કે જે લોકો ડિમેટમોડમાં શેર્સ દ્યારણ કરતા હોય તેમને જણાવવાનું કે કંપની તેમના શેર્સ આઇઇપીએફના ડિમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે કોર્પોરેટ એકશનના માધ્યમથી ડિપોઝિટરીને

સંબંધિત શેરધારકોને વિનંતી કરવામાં આવે છે કે તેમણે ક્લેઇમ નહીં કરેલા ડિવિડન્ડનો ક્લેઇમ તેઓ તુરંત જ એક અરજી કરીને તેની સાથે પત્રમાં ઉલ્લેખિત જરૂરી દસ્તાવેજો રજૂ કરી લિંક ઇન્ટાઇમ ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ, ૨જીસ્ટ્રા૨ અને શે૨ ટ્રાન્સફ૨ એજન્ટ ("આ૨ટીએ"), પાંચમો માળ, ૫૦૬-૫૦૮, અમરનાથ બિઝનેસ સેન્ટર-૧ (એબીસી-૧), ગાલા બિઝનેસ સેન્ટરની બાજુમાં, સેન્ટ ઝેવિચર્સ કોલેજ કોર્નર નજીક , ઓફ સી .જુ .રોડ , એલિસબ્રીજ , અમદાવાદ - ૩૮૦૦૦૬. ફોન: +૦૭૯ ૨૬૪૬૫૧૭૯, ઇમેલ: <u>ahmedabad@linkintime.com</u> વેબસાઇટ: <u>www.linkintime.co.in</u> ; ને મોક્લી આપે .

સંબંધિત શેરધારકોને એવી પણ વિનંતી કરવામાં આવે છે કે શેર્સના ટ્રાન્સફર અથવા ડિવિડન્ડની ચૂકવણી વગેરે સામે કોઇ મનાઇ હુકમ / નિયંત્રણ આદેશો વગેરે કોઇ કોર્ટ / વૈદ્યાનિક સત્તા પાસેથી મેળવવામાં આવ્યા હોય તો તેની એક નકલ સાથે કંપનીને તે બાબતે તાત્કાલિક જાણ કરવામાં આવે .

शेरधारडोએ नोंध લेवी डे डंपनी द्वारा संजंधित शेरहोट्डर्सनी विगतो तेनी વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલ છે અને તેને આઇઇપીએફ ઓથોરિટીનાં ડિમેટ એકાઉન્ટમાં શેર્સ ટ્રાન્સફર કરવા માટે પર્ચાપ્ત નોટિસ માનવામાં આવશે.

शेरधारडोએ એनी पए। नोंध લેવી કે અનક્લેઇન્ડ ડિવિડન્ડ અને शेर्स કે જે આઇઇપીએફ ઓથોરિટી ખાતે તબદીલ થઇ ગચેલા હોય અને તે શેર્સ ઉપરના બધાજ લાભો જો પરત મળેવવા માંગતા હોચ તો તેમને વેબ ફાર્મે આઇઇપીએફ - ૫ માં ઓનલાઇન એપ્લીકેશન કરી સહી કરેલ (કંપની સાથે નોંધાયેલા નમુનાના હસ્તાક્ષર મુજબ) વેબ ફોર્મ તેમાં જણાવેલ આવશ્ચકતા મુજબના દસ્તાવેજો જોડીને કંપનીને ઉપર જણાવેલ સરનામે મોકલાવી આપવા. વધુમાં જણાવવાનું કે રૂલ્સના અનસંધાનમાં કંપની દ્વારા અનક્લેઇન્ડ ડિવીડન્ડ અને શેર્સ કે જે આઇઇપીએક ઓથોરિટીમાં ટ્રાન્સફર કરવામાં આવશે , તેના અંગે કંપની વિરૂધ્ધમાં કોઇ દાવો કરી

જો કંપનીને સંબંધિત શેરધારકો તરફ થી **એપ્રિલ ૧૫, ૨૦૨૩** સુધીમાં કોઇ જવાબ નહી મળે તો કંપની રૂલ્સમાં નિર્દિષ્ટ આવશ્ચકતાઓ પુરી કરવા અને રૂલ્સમાં નિયત કરાયેલી કાર્યવાહી અનુસાર શેર્સ આઇઇપીએફ ઓથોરિટીના ડિમેટ એકાઉન્ટમાં ટાન્સક્ટ કરશે.

જે શેરધારકો ફિઝીકલ શેર્સ ધારણ કરે છે તેમને સિક્યોરીટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇંડિયા (સેબી)એ ફરજિયાત પણે તેમના પાન , કેવાયસી અને નામાંકન કંપનીના રજિસ્ટ્રાર એન્ડ ટ્રાન્સફર એજન્ટ (આરટીએ)ને રજૂ કરવા જણાવેલ છે. જે શેરધારકો જરૂરી વિગતો અને દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહેશે, તેમના ફોલિયો આરટીએ દ્વારા **એપ્રિલ ૧, ૨૦૨૩** કે પછીથી સ્થગિત કરવામાં આવશે. ઉપર જણાવેલ વિગતો વધુમાં કંપનીની વેબસાઈટ <u>https://www.torrent</u> power.com/index.php/investors/holdingshares પર ઉપલબ્ધ છે.

શેરદારકોને ઉપર દર્શાવેલ બાબતમાં કોઈ પ્રશ્નો હોય તો તેઓ કંપનીના આરટીએ અથવા કંપનીને ઉપર દર્શાવેલ સરનામા ઉપર સંપર્ક કરવો .

> ટોરેન્ટ પાવર લિમિટેડ વતી રાહુલ શાહ કંપની સેક્રેટરી

અધિકૃત અધિકારી ભારતીય સ્ટેટ બેંક

Place: Mumbai Date: January 11, 2023

સ્થળઃ અમદાવાદ તારીખઃ જાન્યુઆરી ૧૨, ૨૦૨૩

Careers Advertisement No. RECT/ADMIN0001/2023

(Job Ref. No. 50379944)

INDIAN INSTITUTE OF TECHNOLOGY BOMBAY Powai, Mumbai - 400 076

Indian Institute of Technology Bombay, an Institute of national importance adjudged as Institute of Eminence, invites online application for following position(s) of the No. of Position & **Pay Details** Name of the Post No. Reservation 1. Jr. Engineer

Pay Level 6

(35400 - 112400)

For details regarding essential educational qualification, experience, general instructions visit IIT Bombay website https://www.lltb.ac.ln/en/careers/staff-recrultment

The date of closing of online application interface is 09.02.2023. REGISTRAR Date: 10.01.2023

Container Corporation of India Limited

Executive Director (Finance) & CS

For & on behalf of

જોઇએ.

Company for the guarter and period ended on 31st December, 2022.

This information is also available on the website of the Company and the websites of the Stock Exchanges where the Company's shares are listed viz. BSE Limited (www.bseindia.com) and the National Stock Exchange of India Limited (www.nseindia.com).

Place : New Delhi

Hyderabad Bench.

mentioned below:

Dist. Virudhunagar, Tamil Nadu

Date: January 12, 2023

તભ્યોને ઈલક્ટ્રોનિક રીતે (રિમોટ ઈ–વોટીંગ)

Place: Mumbai

IMP

Date: 09.01.2023

CIN: L63011DL1988GOI030915, Tel. Nos.: 011-4122 2500/ 600/ 700
E-mail: investorrelations@concorindia.com Website http://www.concorindia.co.in
NOTICE

Notice is hereby given pursuant to Regulation 47 read with Regulation 29 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a Meeting of the Board of Directors of the Company will be held on 23" January, 2023 to inter-alial consider and approve the unaudited Financial Results of the Company for the quarter and period ended on 31" December, 2022 and declaration of 3" Interim Dividend for FY 2022-23, if any, to the shareholders. Further, in terms of SEBI (PIT) Regulations, 2015, as amended, the Trading Window for dealing in Equity Shares of the Company is closed for all designated persons & their immediate relatives for the period from 01" January, 2023 till the expiry of 48 hours after declaration of the Financial Results of the